



Transpek Industry Limited

Reg. Office:
4th Floor, Lilleria 1038
Gotri - Sevasi Road
Vadodara - 390021. Gujarat, (India)

Company Identification No.: L23205GJ1965PLC001343

Sec/Unaudited Fin Results/2026/

Date: 9th February, 2026

To,
BSE Limited,
P.J. Towers, Dalal Street,
Mumbai - 400 001

Ref: Scrip Code: 506687

Sub: Newspaper Advertisement – Intimation pursuant to regulation 47 of of SEBI (LODR) Regulations, 2015.

Dear Sir/Madam,

We refer to our letter dated 4th February, 2026, informing about the Company's Unaudited Financial Results for the quarter and nine months ended 31st December, 2025. In this connection and pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed the newspaper advertisements published in newspapers as mentioned below:

Sr. No.	Name of Newspaper(s)	Publication Date	Edition
1	Business Standard	6 th February, 2026	All
2	Vadodara Samachar	6 th February, 2026	Vadodara

The above information will also be made available on the Website of the Company at www.transpek.com

Kindly take the information on your record.

Thanking you,
Yours faithfully,
For Transpek Industry Limited


Alak D. Vyas
Company Secretary &
Compliance Officer



Works:
At. & Post: Ekalbara
Taluka: Padra
Dist.: Vadodara - 391 440
Gujarat (India)
Ph.: +91-2662-244444, 244318, 244309
Fax: +91-2662-244439, 244207



www.transpek.com
WEBSITE
inquiry@transpek.com
EMAIL



ONELIFE CAPITAL ADVISORS LIMITED
CIN: L74140MH2007PLC173660;
Registered Office: Plot No. A 356, Road No. 26, Wagle Industrial Estate, MIDC, Thane (W), - 400604, Tel No: 022 41842222; Fax: 022 41842228
Email: cs@onelifeadvisors.in; Website: www.onelifeadvisors.in

NOTICE OF POSTAL BALLOT & E-VOTING INFORMATION
Members of the Company are hereby informed that pursuant to Section 108 and 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 (the "Act") and Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 and the General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020 and subsequent circulars issued in this regard, the latest being circular no. 09/2023 dated September 25, 2023 issued by the Ministry of Corporate Affairs (collectively called "MCA Circulars"), the Company has sent the Notice on February 05, 2026, only through electronic mode, to those Members whose e-mail addresses are registered with the Company/RTA/ Depositories and whose names are recorded in the Register of Members of the Company or Register of Beneficial Owners maintained by the Depositories as on Friday, January 30, 2026 ("Cut-off date"). Accordingly, physical copy of the Notice along with Postal Ballot Form and pre-paid business reply envelope has not been sent to the Members for this Postal Ballot. Notice is hereby given that Onelife Capital Advisors Limited (the "Company") is seeking approval of the Members of the Company by way of Postal Ballot through Remote E-voting on the following resolutions:

Sr. No.	Description of the Resolution(s)	Type of Resolution
1	Re-appointment Of Dr. Ranu Jain (Din: 11012104) As Non-Executive Independent Director Of The Company For Second Term Of 5 Year	Special Resolution
2	Re-appointment Of Mr. Nitesh Singh (Din: 08707310) As Non-Executive Independent Director Of The Company For Second Term	Special Resolution
3	Re-appointment Of Mr. Abhay Sethia (Din: 09721583) As Non-Executive Independent Director Of The Company For Second Term	Special Resolution

The Notice of Postal Ballot ("Notice") is available on the website of the Company at www.onelifeadvisors.in and can also be downloaded by accessing website of the CDSL at www.evotingindia.com and at the relevant sections of the websites of the BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com. The Company has engaged the services of CDSL, to provide remote e-voting facility. The remote e-voting facility will be available during the following period:

Commencement of Remote e-Voting	Friday, 06 February, 2026 at 09.00 AM
Completion of Remote e-Voting	Saturday, March 07, 2026 at 05:00 PM

Please note that communication of assent or dissent of the members would only take place through the remote e-voting system. The voting rights of the members shall be in proportion to the shares held by them in paid-up equity share capital of the company as on the cut-off date. A person who is not a member as on cut-off date should treat this Notice for information purpose only. Once the vote on a resolution is cast, members shall not be allowed to change it subsequently. The remote e-voting shall not be allowed beyond 5:00 PM on Saturday, March 07, 2026 at 05:00 PM and the remote e-voting module shall be disabled by CDSL thereafter. Members who have not registered their email ID are requested to register the same in the following manner:

a) Members holding shares in physical mode and who have not registered/updated their email ID with the Company are requested to register/update their email ID with KFinTech by sending duly signed request letter at inward_ris@kfintech.com with details of folio number and attaching a self-attested copy of PAN card.

b) Members holding shares in dematerialised mode are requested to register/update their email ID with the relevant Depository Participant with whom they maintain their demat account(s).

The Board of Directors of the Company has appointed M/s M Siroya and Company, Company Secretaries, as the Scrutinizer to conduct the postal ballot through remote e-voting process in a fair and transparent manner. The result of postal ballot will be announced within two working days from the date of passing the resolutions. The said results along with the Scrutinizer's Report would be intimated to BSE Limited and National Stock Exchange of India Limited and will also be uploaded on the Company's website at www.onelifeadvisors.in and on the website of CDSL website www.evotingindia.com. In case of any queries pertaining to e-voting or in relation to the Resolutions proposed to be passed by this Postal Ballot may be addressed to Secretarial Department at Email: cs@onelifeadvisors.in or for any query/ grievance with respect to e-Voting, you can write an email to helpdesk.evoting@cdslindia.com or call at toll free no. 1800 21 09911.

Place : Thane
Date : 5/02/2026

Company Secretary & Compliance Officer
ACS: 76294



ASSAM POWER GENERATION CORPORATION LIMITED
NOTICE INVITING TENDER

e-Tenders are invited from the intending contractors/firms/suppliers for execution of **"Major Overhauling along with Supply of Spares of the BHEL make 37.2 MW Steam Turbine (HNK 71/2.8-4, T-669) and Steam Turbine Generator (TARI 800-24P, TG1587) Unit-8 of Waste Heat Recovery Project (WHRP) at Lakwa Thermal Power Station, APGCL, Maibella"**, required in **Assam Power Generation Corporation Limited under the Department of Power, Govt. of Assam**. An amount of **INR 18,00,000.00 (Rupees Eighteen Lakh only)** is to be submitted as EMD/Bid Security. The Tender documents can be downloaded from www.assamtenders.gov.in from 06/02/2026 (10:00 hours).

- The last date of submission of tender document is 02/03/2026 (12:00 hours)**
- The bids will be opened online on the e-procurement portal on 06/03/2026 (12:00 hours)**

The TIA reserves the right to accept or reject any bid/tender, and to cancel/ annul the bidding process and reject all bids at any time prior to contract award.

Name of the TIA: Chief General Manager (Gen), APGCL
Address of the TIA: 3rd Floor Bijulee Bhawan, Paltanbazar, Guwahati - 781005

Sd/- Chief General Manager (Gen)
APGCL, Bijulee Bhawan, Guwahati - 781005




SCOOBEE DAY GARMENTS (INDIA) LIMITED
CIN: L27100KL1994PLC008083
Regd. Office: 666/12, Anna Aluminium Building, Kizhakkambalam, Aluva, Ernakulam, Kerala - 683562
Web: www.scoobeedaygarments.com
E-mail: info@scoobeedaygarments.com | Tel. No. 0484 2680701

SPECIAL WINDOW FOR TRANSFER AND DEMATERIALISATION OF PHYSICAL SHARES
Pursuant to SEBI Circular No. HO/38/13/11(2)2026-MIRSD-POD/1/3750/2026 dated January 30, 2026, all shareholders are hereby informed that a Special Window has been opened for a period of one year, from February 5, 2026 to February 4, 2027 to facilitate transfer and dematerialisation of physical securities which were sold/purchased prior to April 01, 2019. The said special window shall also be available for such transfer requests which were submitted earlier and were rejected/returned/not attended to due to deficiency in the documents/process/or otherwise. Further, the securities so transferred shall be mandatorily credited to the transferee only in demat mode and shall be under lock-in for a period of one year from the date of registration of transfer. Such securities shall not be transferred/lien-marked/ pledged during the said lock-in period. Investors are encouraged to take advantage of this opportunity by furnishing the necessary documents to the Company's Registrar and Share Transfer Agent i.e, Cameo Corporate Services Limited, "Subramanian Building", No.1, Club House Road, Chennai - 600 002.

For Scoobee Day Garments (India) Limited
Sd/-
Ernakulam
February 06, 2026

Alphonsa Jose
Company Secretary and Compliance Officer



ELNET TECHNOLOGIES LIMITED
Regd. Office: TS 140, Block 2 & 9, Rajiv Gandhi Salai, Taramani, Chennai - 600 113.
Ph: 044-2254 1337 / 1098 Fax: 044-2254 1955 Email : elnetcity@gmail.com Website: www.elnettechnologies.com
CIN : L72300TN1990PLC019459

Extract of Unaudited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2025
Rs. in Lakhs


Sl. No.	Particulars	Quarter Ended			Nine Months Ended		Year Ended	
		December 31, 2025 (Un-audited)	September 30, 2025 (Un-audited)	December 31, 2024 (Un-audited)	December 31, 2025 (Un-audited)	December 31, 2024 (Un-audited)	March 31, 2025 (Audited)	March 31, 2024 (Audited)
1	Total Income from Operations	906.38	909.74	836.35	2,687.94	2,502.16	3,325.30	3,442.79
2	Net Profit for the period (before tax and exceptional items)	628.23	640.32	581.74	1,855.78	1,729.15	2,289.89	2,353.50
3	Net Profit for the period before tax (after exceptional items)	628.23	640.32	581.74	1,855.78	1,729.15	2,289.89	2,353.51
4	Net Profit for the period after tax (after exceptional items)	502.69	502.26	432.04	1,506.92	1,281.80	1,755.22	1,749.17
5	Other comprehensive income (net of tax)	-	-	-	-	-	1.39	2.78
6	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	502.69	502.26	432.04	1,506.92	1,281.80	1,756.62	1,751.95
7	Equity Share Capital (face value of Rs.10 per share)	400.00	400.00	400.00	400.00	400.00	400.00	400.00
8	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	15,225.16	13,536.09
9	Earning per share (Rs) (not annualised expect for the year ended March 2019)							
	a. Basic	12.57	12.56	10.80	37.67	32.05	43.88	43.73
	b. Diluted	12.57	12.56	10.80	37.67	32.05	43.88	43.73


Notes:

- The unaudited financial results have been reviewed by the Audit committee and approved by the board of directors at their respective meeting, held on 05-02-2026. The financial results are prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013.
- The company is engaged in the sole activity of carrying on the business of "Promotion and Maintenance of Software Technology Park" and therefore, has only one reportable segment in accordance with Ind AS 108 "Operating Segments". Hence, no separate segment reporting is applicable to the company.
- Previous year/period's figures have been regrouped/recast, wherever necessary, to confirm to the classification of the current year/period's classification

Place : Chennai
Date : 05.02.2026

For and on behalf of the Board
Mrs. Unnamalai Thiagarajan
Managing Director
(DIN:00203154)





Registered Office : P.O. Hargaon, District Sitapur, Uttar Pradesh - 261 121
Phone (05862) 256220; Fax (05862) 256225,
CIN : L15122UP2015PLC069635
Website: www.avadhsugar.com, Email: birlasugar@birla-sugar.com


Extract of the Unaudited Financial Results for the quarter and nine months ended 31 December 2025
(₹ in lakhs)

Sr. No.	Particulars	Three months ended 31.12.2025	Nine months ended 31.12.2025	Corresponding Three months ended 31.12.2024 in the previous year
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Income from Operations	63,814.71	2,02,290.48	61,680.12
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	2,957.38	615.28	1,081.26
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	2,657.70	315.60	1,081.26
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	1,669.71	169.30	674.08
5	Total Comprehensive Income / (Loss) for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income / (Loss) (after tax)]	1,117.17	(999.41)	(2,820.42)
6	Equity Share Capital	2,001.84	2,001.84	2,001.84
7	Other Equity			
8	Earning per share (of ₹10/- each) (in ₹): Basic & Diluted	8.35 *	0.85 *	3.37 *

* Not annualised.

Note:
The above is an extract of the detailed format of the Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results of the Company are available at our website <https://www.avadhsugar.com> and at website of BSE Limited and National Stock Exchange of India Limited at <https://www.bseindia.com> and <https://www.nseindia.com> respectively.

Place : Kolkata
Date : 5 February 2026



For and on behalf of Board of Directors
AVADH SUGAR & ENERGY LIMITED
Chandra Shekhar Nopany
Co-Chairperson & Managing Director
DIN - 00014587




INDIAN INSTITUTE OF MANAGEMENT RANCHI
VERY SHORT TENDER NOTICE
IIM Ranchi invites tenders from public sector banks and eligible private sector banks for 'Interest Rates on Fixed Deposit for IIM Ranchi'. The last date for submission of the sealed bid is up to 12:30 PM on 10.02.2026. For More details, please refer to our website: www.iimranchi.ac.in.



INDIAN INSTITUTE OF MANAGEMENT RANCHI
VERY SHORT TENDER NOTICE
IIM Ranchi invites tenders from eligible bidders for Tent, Light and Banner for 'SOUL Carnival - Social Impact Conference' Event 2026. The last date for submission of the sealed bid is up to 03.00 PM on 12.02.2026. For More details, please refer to our website: www.iimranchi.ac.in



सेंट्रल बैंक ऑफ इंडिया
Central Bank of India
Expression of Interest (EOI) for selection of contractor for proposed waterproofing of terrace at Bank's quarters at Cent Pearl, Belapur CBD, Navi Mumbai - 400614. For detailed information of EOI documents please visit Bank's website - <https://www.centralbank.bank.in> under live tenders section. Last date and time for document submission is 23/02/2026 upto 15.00 hrs.
Date: 05/02/2026 DGM
Place: Mumbai Business Support Deptt



Transpek Industry Limited
Registered Office : 4th Floor, Lilleria 1038, Gotri Sevasi Road, Vadodara - 390021.
Tel : 0265 - 6700300
Email : secretarial@transpek.com Website : www.transpek.com
CIN : L23205GJ1965PLC001343


STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2025

PARTICULARS	Standalone (Rs. In Lakhs)						Consolidated (Rs. In Lakhs)					
	Quarter ended			Nine Months ended		Year ended	Quarter ended			Nine Months ended		Year ended
	31st Dec., 2025 (Unaudited)	30th Sept., 2025 (Unaudited)	31st Dec., 2024 (Unaudited)	31st Dec., 2025 (Unaudited)	31st Dec., 2024 (Audited)	31st March, 2025 (Audited)	31st Dec., 2025 (Unaudited)	30th Sept., 2025 (Unaudited)	31st Dec., 2024 (Unaudited)	31st Dec., 2025 (Unaudited)	31st Dec., 2024 (Audited)	31st March, 2025 (Audited)
Revenue from Operations	15,847.79	16,027.24	17,003.94	47,298.36	48,459.66	64,985.31	15,847.79	16,027.24	17,003.94	47,298.36	48,459.66	64,985.31
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1,446.49	1,696.65	1,357.62	5,236.27	3,713.45	6,165.93	1,446.36	1,696.61	1,357.51	5,236.04	3,713.12	6,165.55
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1,446.49	1,696.65	1,357.62	5,236.27	3,713.45	6,165.93	1,446.36	1,696.61	1,357.51	5,236.04	3,713.12	6,165.55
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1,084.69	1,263.90	1,064.67	3,906.73	2,948.90	4,874.07	1,084.56	1,263.86	1,064.56	3,906.50	2,948.57	4,873.69
Total Comprehensive Income for the period [comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	823.31	1,443.14	(2,739.37)	4,202.17	9,633.82	7,975.14	823.18	1,443.10	(2,739.48)	4,201.96	9,633.49	7,974.76
Equity Share Capital	558.56	558.56	558.56	558.56	558.56	558.56	558.56	558.56	558.56	558.56	558.56	558.56
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	73,975.01	-	-	-	-	-	73,973.34
Earnings Per Share (of Rs.10/- each)												
Basic & Diluted (Rs.)	19.42	22.62	19.06	69.94	52.79	87.26	19.42	22.62	19.06	69.94	52.79	87.25

Notes :

- The above is an extract of the detailed format of Unudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the Company's website at www.transpek.com and the Stock Exchange's Website at www.bseindia.com.
- On November 21, 2025, the Government of India notified the four Labour Codes - the Code on Wages, 2019; the Industrial Relations Code, 2020; the Code on Social Security, 2020; and the Occupational Safety, Health and Working Conditions Code, 2020 - consolidating 29 existing labour laws. The Ministry of Labour & Employment subsequently published draft Central Rules and FAQs to enable assessment of the financial impact arising from the revised regulatory framework. Accordingly, the Company assessed the impact of these changes and based on the information available as of date, certain estimates and actuarial valuation, has made an incremental provision towards Gratuity of ₹ 137.32 lakhs under the head "Employee Benefits Expense" in the Statement of Unaudited Financial Results for the quarter and nine months ended December 31, 2025. The Company continues to monitor the finalisation of Central / State Rules and clarifications from the Government on other aspects of the Labour Codes and would provide appropriate accounting effect on the basis of such developments as needed.
- The same can be also accessed by scanning the QR Code provided here.

Date : February 04, 2026
Place : Vadodara



For TRANSPEK INDUSTRY LIMITED
Sd/-
BIMAL V. MEHTA
MANAGING DIRECTOR
DIN: 00081171

ક્રાફ્ટોન ઇન્ડિયા નવરચના યુનિવર્સિટી, વડોદરામાં લઇને આવ્યું છે, રાષ્ટ્રવ્યાપી કોલેજ કેમ્પસ ટૂર

કોલેજ અગ્રણી બીજીએમઆઇ અને રીઅલ ક્રિકેટ ટુર્નામેન્ટ્સ કેમ્પસ પ્લેથી લઇને ઓર્ગનાઇઝ્ડ સંગઠિત ઇ-સ્પોર્ટ્સ સ્પર્ધા સુધીના સ્પષ્ટ પ્રગતિના રસ્તા ખોલે છે

● વડોદરા, ફેબ્રુઆરી, ૨૦૨૬

ક્રાફ્ટન ઇન્ડિયા દ અને ઉ ફેબ્રુઆરીએ નવરચના યુનિવર્સિટી, વડોદરામાં તેનો રાષ્ટ્રવ્યાપી કોલેજ કેમ્પસ ટૂર લાવી રહ્યું છે, જે સ્થાનિક ઇ-સ્પોર્ટ્સ કમ્યુનિટી માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેની મુખ્ય પ હેલની બીજી આવૃત્તિના ભાગ રૂપે, કેમ્પસ એક્ટિવેશનને પ્રોત્સાહનથી રીતે તથા કરીને ટુર્નામેન્ટ્સને સીધા xબિલ્ડક્રોનમાં એકીકૃત કરશે, જે વિદ્યાર્થીઓને એક સંગઠિત સ્પર્ધાત્મક વાતાવરણમાં સ્પર્ધા કરવાની પ્રથમ તક આપશે.

નવરચના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બીજીએમઆઈ અને રિયલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રમાણિત ફોર્મેટની સાથે અનુભવી ટુર્નામેન્ટ ઓવરસાઈટ તથા સ્પષ્ટ પ્રગતિ માગોની સાથે તેમાં ભાગ લેશે. કેન્સ્ટ્રુઅલ ગેમિંગથી વિપરીત, સ્પર્ધાત્મક પ્રક્રિયાઓ ઇ-સ્પોર્ટ્સની રચના અને સ્પર્ધાત્મક તીવ્રતાનો અનુભવ કરશે, જે સત્તાવાર નિયમો, લાઈવ કોમેન્ટરી અને ટોચના પ્રદર્શનકારો માટે માન્યતા સાથે આગળ વધશે.

વડોદરામાં હાલના તબક્કે વિદ્યાર્થીઓની

ભારે માંગને કારણે ૧૨૮ કોલેજોમાં રાષ્ટ્રવ્યાપી વિસ્તરણનો એક ભાગ છે. પ્રવાસની પ્રથમ આવૃત્તિમાં ભારતભરના ૫૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા, શરૂઆતમાં આ કાર્યક્રમ ૬૪ કોલેજો માટે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેની વર્તમાનમાં તેની પહોંચ ૮૫ કોલેજ સુધી વિસ્તરી હતી એટલે કે, ૩૨%નો વધારો જોવા મળ્યો છે. આ વૃદ્ધિ એ મેટ્રો શહેરોના બહાર ઉભરતા ઇ-સ્પોર્ટ્સ હબમાં કોલેજ સ્તરે વિશ્વસનીય સ્પર્ધાત્મક પ્લેટફોર્મ માટેની વધતી જતી ભૂમિને પ્રતિબિંબિત કરે છે.

કોટક ફ્લેક્સીકેપફંડે લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં તેની સફરના ૧૫ વર્ષ પૂરા કર્યા

શરૂઆતથી ૧૬.૫૯ ટકા સીએજીઆર નોંધાવ્યોફ, જે બજાર ચક્રમાં મજબૂત અને સુસંઘત કામગીરી દર્શાવે છે

● મુંબઈ, ૫ ફેબ્રુઆરી, ૨૦૨૬

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ ("KAMAC"/ "Kok Mutual Fund") એ કોટક ફ્લેક્સીકેપફંડ ★ ના ૧૫ વર્ષ પૂરા કર્યાની સીમાચિહ્નિ જાહેરાત કરી છે. આ સ્કીમે શરૂઆતથી જ ૧૬.૫૯ ટકાનો સીએજીઆર નોંધાવ્યો છે અને વિવિધ બજાર વાતાવરણમાં મજબૂત લાંબા ગાળાના પરફોર્મન્સનો રેકોર્ડ બનાવ્યો છે. કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, "કોટક ફ્લેક્સીકેપફંડ ૧૫ વર્ષ પૂરા કરે છે તે અમારા માટે અને ફંડ પ્રત્યે પ્રતિબદ્ધ રહેલા રોકાણકારો માટે ગવર્નિંગ પ્રણાલિ છે. એક ટેકેગરી તરીકે ફ્લેક્સીકેપમહત્વપૂર્ણ છે કારણ કે તેના દ્વારા રોકાણકારો ભારતના વિકાસમાં ભાગ લઈ શકે છે અને માર્કેટ કેપિટલાઈઝેશનમાં ફાળવણીના નિષ્ણો અનુભવી રોકાણકારો પર છોડી દે છે."

૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં,

કોટક ફ્લેક્સીકેપફંડ ડાયરેક્ટ પ્લાન - ગ્રોથ ઓપ્શન ૧૦ વર્ષમાં ૧૫.૦૦ ટકા સીએજીઆર અને ૫ વર્ષમાં ૧૬.૮૭ ટકા સીએજીઆર નોંધાવ્યો છે. આ ફંડનું સંચાલન કોટક મહિન્દ્રા એએમસીના સીઆઈઓ હર્ષ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવે છે, જેમની ફિલોસોફી ટકાઉ કમાણી, મજબૂત શાસન અને મૂડી કાર્યક્ષમતામાં રહેલી છે. હર્ષ ઉપાધ્યાયે ઉમેર્યું હતું કે, "કોટક ફ્લેક્સીકેપફંડ ટકાઉ કમાણીની સંભાવના અને મજબૂત મૂડી કાર્યક્ષમતા ધરાવતા વ્યવસાયો સાથે જોડાયેલા રહીને ૧૫ વર્ષના વૈવિધ્યસભર બજાર ચક્રને પાર કર્યું છે. અમારું ધ્યાન હંમેશા ટૂંકા ગાળાના વલણોનો પીછો કરવાને બદલે ઊંડા સંશોધન દ્વારા સમર્થિત સ્ટોક પસંદગી પર રહ્યું છે. આ અભિગમથી ફંડ ભારતના વિકાસમાં અપૂર્ણ રીતે ભાગ લે છે જ્યારે રોકાણકારો માટે સતત લાંબા ગાળાના પરિણામો આપવાનું લક્ષ્ય રાખે છે."

ફ્લેક્સીકેપફંડ્સ લાજ, મીડ અને સ્મોલ કેપસેગમેન્ટમાં રોકાણ દ્વારા બજારના વાતાવરણમાં ચળવળ પ્રદાન સંબંધીને દર્શાવે છે, જે બ્રાન્ડના રિજનલ કનેક્ટને વધુ મજબૂત બનાવે છે. આધુનિક ભારતીય મહિલાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ BIBAનું SS26 કલેક્શન, બ્રાજી સિલુએટ્સ, ફેશ કલર પેલેટ્સ અને ઈન્ટિયન ડેઝના આધુનિક સ્વરૂપનું અનોખું મિશ્રણ છે, જે સમર સીઝન માટે એકદમ યોગ્ય છે. આ કલેક્શનમાં ડે-વેર, વર્ક-વેર અને ઓકેઝન-વેર એમ તમામમાં કોટન કાપડ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રોજિંદા પહેરવેશની સરળ સ્ટાઈલથી લઈને લગ્ન પ્રસંગો માટેના ભવ્ય આઉટફિટ્સ સુધી, આ સમગ્ર કલેક્શન BIBA ની "Easy Breezy" ફિલોસોફીને પ્રતિબિંબિત કરે છે. જીજીર દે રેન્જમાં રૂ. ૨,૫૮૯ થી શરૂ થતા સૂટ સેટ્સની એક શાનદાર રેન્જ પણ રજૂ કરવામાં આવી છે, જે વ્યાજબી કિંમતે પ્રીમિયમ ગુણવત્તાવાળા ભારતીય પહેરવેશ પ્રદાન કરવાની BIBAની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે. આ સાથે જ, તહેવારો અને ખાસ પ્રસંગો માટે બ્રાન્ડની શાનદાર વેડિંગ રેન્જ પણ રજૂ કરી છે. લોન્ચિંગ દરમિયાન વડોદરા સ્ટોર ઉત્સાહસભર બની રહ્યો, જ્યાં ગ્રાહકો અને ફેશ પ્રેમીઓએ નવા કલેક્શનની ખરીદી કરી હતી અને જાનકી બોડીવાલા સાથે મુલાકાત કરી હતી. સમગ્ર ગુજરાતમાં BIBAનું મજબૂત ટિલે નેટવર્ક છે તે ભારતીય પહેરવેશ માટેની પ્રથમ પસંદગી બનાવે છે, જે સ્થાનિક રુચિને માન આપવાની સાથે વૈશ્વિક સ્તરે આધુનિક પણ રહ્યું છે.

સ્ટોરની મુલાકાત દરમિયાન સિદ્ધાર્થ બિંદ્રા, મેનેજિંગ ડિરેક્ટર, BIBA ફેશન લિમિટેડ એ જણાવ્યું હતું કે, "ગુજરાત હંમેશા BIBA માટે એક મુખ્ય માર્કેટ રહ્યું છે, અને અમારી રિટેલ સફરમાં

એમેઝોનએ એગ્રીકલ્ચરલ વેસ્ટમાંથી નવીન પેકેજિંગ ઉકેલો વિકસાવવા માટે IY રુરકી સાથે ભાગીદારી કરી

સંશોધન ભાગીદારી વર્જિન વુડ પલ્પરની નિર્મરતા ઘટાડવા માટે મજબૂત, ટકાઉ પેપર મેઇલર્સ વિકસાવે છે અને સ્ટબલ-બર્નિંગ પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે

વડોદરા, ફેબ્રુઆરી, ૨૦૨૫: એમેઝન ઇન્ડિયાએ આજે એગ્રીકલ્ચરલ વેસ્ટ (કૃષિ બગડા)માંથી નવીન પેકેજિંગ મટીરિયલ વિકસાવવા માટે ઈન્ટિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) રુરકી સાથે ભાગીદારી કરી હોવાની ઘોષણા કરી છે. આ પ્રોજેક્ટનો હેતુ નોન-વુડ (લાડાવિહીન) પેપર ટેકનોલોજીનું સર્જન કરવાનો છે જે એગ્રીકલ્ચર વેસ્ટને બાળવાને બદલે વર્જિન વુડ પલ્પરના દબાણમાં ઘટાડો કરે છે. આ વર્જનમાં હળવા છે પરંતુ મજબૂત પેકેજિંગ મટીરિયલ છે જે પરંપરાગત વુડ પલ્પરપર

અથવા પ્લાસ્ટિક બેગ્સ સામે રિસાયકલેબલ અને હોમ-કોમ્પોસ્ટેબલ વિકલ્પપ્રદાન કરે છે. આ સંશોધન ઘઉંની દાંડી અને બેગસ જેવા પાકના અવશેષોને કાળજીના મેઈલર્સ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પલ્પરમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે પરંપરાગત કાળજી પેકેજિંગની તુલનામાં કાર્યક્ષમ હશે. આ એગ્રીકલ્ચરલ વેસ્ટને મુલ્યવાન પેકેજિંગ સામગ્રીમાં ફેરવીને ભારતમાં સ્ટ્રોબલ (લણણી પછી રહેલ ચૂંચ પાક) બાળવાનું ઘટાડામાં મદદ કરે છે. તે આયાતી વર્જિન

લાકડાના પલ્પરની નિર્મરતા પણ ઘટાડે છે અને કૃષિ અવશેષો માટે બજાર પૂરું પાડીને ખેડૂતો માટે વચારાની આવક બનાવી શકે છે. IIT રુરકીના પેપર અને પેકેજિંગ ટેકનોલોજી વિભાગ સાથે સહયોગ ૧૫ મહિનાના સમયગાળામાં લેબ-સ્કેલ વિકાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે પરંપરાગત પરીક્ષણોને આધિન, એમેઝોન આગામી વર્ષના મધ્યથી અંત સુધીમાં ઔદ્યોગિક પરીક્ષણો, પ્રક્રિયા માન્યતા અને વ્યાપારી ઉત્પાદનમાં પ્રગતિ માટે સમર્થન પૂરું પાડશે.

આરઆર કાબેલ ફાઉન્ડેશનના 'રોશની' ઇનિશિએટિવ' દ્વારા શિક્ષણને પ્રોત્સાહન: વડોદરામાં સ્કૂલ બિલ્ડીંગનું નિર્માણ

● વડોદરા, ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬:

આરઆર કાબેલ ફાઉન્ડેશનના સીએસઆર ઇનિશિએટિવ 'રોશની' દ્વારા વડોદરામાં નવી સ્કૂલના નિર્માણ માટે 'બરોડા યંગ ટર્ફ્સ રાઉન્ડ ટેબલ ઈ૨૦૧ ચેરિટેબલ ટ્રસ્ટ' સાથે ભાગીદારી કરવામાં આવી છે. જુલાઈ ૨૦૨૪ માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ જાન્યુઆરી ૨૦૨૬માં પૂર્ણ થયો છે, જેનો મુખ્ય હેતુ વિસ્તારના વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શૈક્ષિક સુવિધાઓ પૂરી પાડવાનો છે. "શિક્ષણ એ મજબૂત સમાજનો પાયો છે, અને આરઆર કાબેલમાં અમે માનીએ છીએ કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો અધિકાર હોવો જોઈએ. વડોદરામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્કૂલ માટે અમારો સહયોગ આ માન્યતાનું જ પ્રતિબિંબ છે. આધુનિક શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરીને, અમે વંચિત સમુદાયના બાળકો માટે વધુ સારી તકો ઊભી કરી રહ્યા છીએ અને સાથે જ આ પ્રદેશના લાંબા ગાળાના વિકાસમાં યોગદાન આપી રહ્યા છીએ." - શ્રીમતી કીર્તી કાબરા, ડાયરેક્ટર, આરઆર ગ્લોબલ એ જણાવ્યું હતું. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્કૂલ તરીકે ઓળખાતું આ નવું શૈક્ષણિક ભવન ૧૪૦૦૦ ચોરસ ફૂટના બાંધકામ વિસ્તારમાં ફંદાવેલું છે અને તે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. કી કીયર્સ ૪ નવી સ્કૂલનું બિલ્ડીંગ: સ્પેસિયસ ક્લાસરૂમ: શાળામાં કુલ સાત ક્લાસરૂમ છે, જે પૈકી દરેક ૫૫૦ થી ૬૪૦ ચોરસ ફૂટના વિસ્તારમાં પથરાયેલા છે. આ ક્લાસરૂમ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે અનુકૂળ અને ઉત્તમ વાતાવરણ પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. વિશિષ્ટ લેબોરેટરીઝ: વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ મળી રહે

તે માટે ૧,૦૦૦ ચોરસ ફૂટની સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળા અને ૧,૨૦૦ ચોરસ ફૂટનું વિજ્ઞાન કમ્પ્યુટર સેન્ટર બનાવવામાં આવ્યું છે.આધુનિક સુવિધાઓ: આ ત્રણ માળનું ભવન (ગ્રાઉન્ડ ૪) અન્ય અનેક વિશેષતાઓ ધરાવે છે, જેમાં શિક્ષકો માટે ખાસ સ્ટાફ રૂમ, લાઈબ્રેરી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અલગ ટોયલેટની વ્યવસ્થા, એક એમ્ફીથિયેટર, સ્કલ્પચર ગાર્ડન અને અત્યાધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમનો સમાવેશ થાય છે. આરઆર કાબેલની આ પ હેલનું ઉદ્ઘાટન ફેબ્રુઆરી ૨૦૨૬માં કરવામાં આવ્યું છે. આ સહયોગ શૈક્ષણિક માળખાગત સુવિધાઓને મજબૂત કરવા અને લાંબા ગાળાના સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેની આરઆર કાબેલની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે વંચિત બેકગ્રાઉન્ડ ધરાવતા બાળકોને શિક્ષણની શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થાય. શિક્ષણ ક્ષેત્રે રોકાણ કરીને, કંપનીનું લક્ષ્ય ભાવિ પેઢીઓને સશક્ત બનાવવાનું અને સમાજ પર એક કાયમી સકારાત્મક પ્રભાવ પડાવવાનું છે.

થવાથી દીડી આવેલા વ્યક્તિઓએ સારવાર અર્થે સલાહ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માત મોતાના બનાવને પગલે કપુરાઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી મૃત હેલને પોસ્ટ મોર્ટમ માટે કોલે રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ટેકર મારનાર બાઈક ચાલકની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સોમા તળાવ યાર રસ્તા પાસે બાઈક ચાલકની ટક્કરે વૃદ્ધ મૃત્યુ પામ્યા

● પ્રતિનિધિ | વડોદરા, તા.૫

વડોદરા શહેરના સોમા તળાવ યાર રસ્તા પાસે બાઈક ચાલકે ચાલતા જતા રાહડારી વૃદ્ધને અકસ્તે બોલે તેમને ગંભીર ઈજાઓ થવાથી મૃત્યુ પામ્યા હતા. અકસ્માત મોતાના બનાવ સંદર્ભે કપુરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા ઘાઘરેટીયા બળીયા દેવ ના મંદિર પાસે રહેતા વિભા ભાઈ બોધા ભાઈ

ભરવાડ ઉંમર વર્ષ ૬૨ થી પાલકનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલ રાત્રે ૯:૩૦ વાગ્યાની આસપાસ વિભા ભાઈ ચાલતા તેમના થ્રા તરફ જતા હતા તે સમયે આ રોડ ઉપરથી પૂર ઝડપે પસાર થતા મોટરસાયકલ ચાલાકે સ્ટેરીંગ પ રનો કામો ગુમાવતા તેમને પાછળથી જોરદાર બાઈકની ટક્કર વાગી હતી. જેમાં તેઓ કૂંચોલની જેમ ઉછળીને રોડ ઉપર પડ્યા હતા આ બનાવમાં તેમને શારીરિક ગંભીર ઈજાઓ

BIBA એ વડોદરા સ્ટોર ખાતે જાનકી બોડીવાલા સાથે તેના SS26 કલેક્શનનું અનાવરણ કર્યું



● વડોદરા, ૩ ફેબ્રુઆરી ૨૦૨૬:

ભારતની અગ્રણી હોમશોન ફેશન બ્રાન્ડ BIBA એ વડોદરા સ્થિત તેના સ્ટોર પર ‘સમર ૨૦૨૬’ કલેક્શન લોન્ચ કર્યું છે. આ પ્રસંગે બ્રાન્ડે લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા સાથેના તેના એસોશિએશનને વધુ મજબૂત બનાવ્યું હતું. આ વિશેષ લોન્ચિંગ ઈવેન્ટમાં BIBA ફેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ બિંદ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ નવા કલેક્શનનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ એસોશિએશન ગુજરાતના ગ્રાહકો સાથે BIBA ના મજબૂત અને વિકસતા સંબંધોને દર્શાવે છે, જે બ્રાન્ડના રિજનલ કનેક્ટને વધુ મજબૂત બનાવે છે. આધુનિક ભારતીય મહિલાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ BIBAનું SS26 કલેક્શન, બ્રાજી સિલુએટ્સ, ફેશ કલર પેલેટ્સ અને ઈન્ટિયન ડેઝના આધુનિક સ્વરૂપનું અનોખું મિશ્રણ છે, જે સમર સીઝન માટે એકદમ યોગ્ય છે. આ કલેક્શનમાં ડે-વેર, વર્ક-વેર અને ઓકેઝન-વેર એમ તમામમાં કોટન કાપડ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રોજિંદા પહેરવેશની સરળ સ્ટાઈલથી લઈને લગ્ન પ્રસંગો માટેના ભવ્ય આઉટફિટ્સ સુધી, આ સમગ્ર કલેક્શન BIBA ની "Easy Breezy" ફિલોસોફીને પ્રતિબિંબિત કરે છે.

જીજીર દે રેન્જમાં રૂ. ૨,૫૮૯ થી શરૂ થતા સૂટ સેટ્સની એક શાનદાર રેન્જ પણ રજૂ કરવામાં આવી છે, જે વ્યાજબી કિંમતે પ્રીમિયમ ગુણવત્તાવાળા ભારતીય પહેરવેશ પ્રદાન કરવાની BIBAની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે. આ સાથે જ, તહેવારો અને ખાસ પ્રસંગો માટે બ્રાન્ડની શાનદાર વેડિંગ રેન્જ પણ રજૂ કરી છે. લોન્ચિંગ દરમિયાન વડોદરા સ્ટોર ઉત્સાહસભર બની રહ્યો, જ્યાં ગ્રાહકો અને ફેશ પ્રેમીઓએ નવા કલેક્શનની ખરીદી કરી હતી અને જાનકી બોડીવાલા સાથે મુલાકાત કરી હતી. સમગ્ર ગુજરાતમાં BIBAનું મજબૂત ટિલે નેટવર્ક છે તે ભારતીય પહેરવેશ માટેની પ્રથમ પસંદગી બનાવે છે, જે સ્થાનિક રુચિને માન આપવાની સાથે વૈશ્વિક સ્તરે આધુનિક પણ રહ્યું છે.

સ્ટોરની મુલાકાત દરમિયાન સિદ્ધાર્થ બિંદ્રા, મેનેજિંગ ડિરેક્ટર, BIBA ફેશન લિમિટેડ એ જણાવ્યું હતું કે, "ગુજરાત હંમેશા BIBA માટે એક મુખ્ય માર્કેટ રહ્યું છે, અને અમારી રિટેલ સફરમાં

રાજપીપળા શહેરમાં મચ્છરો કરતા મસીનો ઉપદ્રવ વધતા લોકો હેરાન

● નર્મદા : તા. ૫

રાજપીપળા શહેરમાં મચ્છરો કરતા મસી નો ઉપદ્રવ વધતા લોકો હેરાન થઈ રહ્યા છે જ્યારે તંત્ર આ મુદ્દે હાથ પર હાથ ધરી બેઠું છે રાજપીપળા માં ભૂતકાળ માં પણ આવી સ્થિતિ જોવા મળી હતી જેમા પાલિકા દ્વારા શહેર માં દવા નો છંટકાવ કરવામાં આવ્યો હતો પરંતુ હાલની સ્થિતિ માં તંત્ર એ કોઈજ પગલા લીધા નથી, આમ તો શહેર માં મચ્છરો પણ છે પરંતુ તેના કરતા મસી નું પ્રમાણ વધું હોય આ મસીઓ રેકેટ માં પણ આવતી નથી માટે ગૃહિણીઓ મસી થી તોબા પોકારી ઊઠી છે.રાજપીપળા શહેર માં હાલ ઉનાળા અને શિયાળા ની બેવડી ઋતુ ચાલી રહી છે ત્યારે માંદગી નું પ્રમાણ વધ્યું હોય ઉપરથી મચ્છર માસુઓ નો ત્રાસ વધતા લોકો હજી બીમારી માં સપડાય તેવી દહેશત જણાય છે.

સાવલી પોલીસે આંતરરાજ્ય 'નાયડુ/ત્રીચી ગેંગ' ના બે સાગરીતોને દબોર્યા: ૫ ગુનાઓનો ભેદ ઉકેલીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે

● સાવલી, તા. ૫


સાવલી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન નજર ચુકવી ચોરી કરતી ગેંગના મહારાષ્ટ્ર અને તામિલનાડુના શખ્સો સાવલી પોલીસે ઝડપી પાડ્યા છે તેના પગલે સાવલી પોલીસને મોટી સફળતા મળી છે. સાવલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ચુસ્ત પેટ્રોલિંગના આધારે આંતરરાજ્ય ગેંગના બે રીડા ગુનેગારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ ૫ થી વધુ ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. ફિલ્મી ઢબે પોછો કરીને આરોપીઓને પકડ્યા

સાવલી પોલીસ મથકના પી.આર્. કે.જે. ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન એક્ટિવા પર જઈ રહેલા બે ઈસમો શંકાસ્પદ જણાતા પોલીસે તેમને ઉભા રહેવા ઈશારો કર્યો હતો. જોકે, આરોપીઓએ વાહન ઉભું રાખવાને બદલે ભાગી જતા પોલીસે ફિલ્મી ઢબે પોછો કરી તેમને ઓવરટેક કરી દબોરી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ વડોદરા શહેર અને સાવલી ભાદરવા ચોકડી પરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે (૧) દેવા મુશ્તા યુવાબસિંહ નાયડુ (ઉ.વ. ૨૭, રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર) (૨) કશા રાજરામ તુડીનાયકર (ઉ.વ. ૩૦, રહે. તિરૂચિરાપલ્લી, તામિલનાડુ)ને ઝડપી



પાડ્યા છે આ ગુનેગારોની ભારે વિચિત્ર મોડસ ઓપરેન્સીઝ હતી જે પોલીસ ની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ અત્યંત ચાલાકીથી ચોરી કરતી હતી. આરોપીઓ રસ્તા પર પસાર થતા લોકોનું ધ્યાન ભટકાવવા માટે “તમારું જેકેટ ગંદુ થયું છે” અથવા “તમારા પૈસા નીચે પડ્યા છે” તેમ કહેતા હતા. જેવી વ્યક્તિ તેની સફાઈમાં કે પૈસા શોધવામાં વ્યસ્ત થાય, કે તરત જ આરોપીઓ ગાડીના કાચ તોડી કે નજર ચુકવીને કિંમતી સામાન ભરેલી બેગ લઈને ફરાર થઈ જતા હતા.

સાવલી પોલીસે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની એક્ટિવા (નંબર GJ-06-SN-1789) તથા રોકડ રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૪૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે સાવલી, આણંદના ઉમરેજ અને ભાલેજ, વડોદરાના જવાહરનગર અને ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ૫ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. મુખ્ય આરોપી દેવા નાયડુ અગાઉ ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાં ૮ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ રેકૉર્ડ પર ખુલ્યું છે.



VOLTAMP TRANSFORMERS LIMITED

Registered Office: Makarpura, Vadodara – 390014, Gujarat.

CIN: L31100GJ1967PLC001437

Tel: 0265 6141403/ 6141480/ 3041480

Email: sanket_act@voltamptransformers.com

Website: www.voltamptransformers.com

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & NINE MONTHS ENDED DECEMBER 31, 2025

(Rs. in Lakhs Except EPS)


Sr. No.	Particulars	Quarter ended 31/12/2025 (Unaudited)	Nine Months ended 31/12/2025 (Unaudited)	Quarter ended 31/12/2024 (Unaudited)	Nine Months ended 31/12/2024 (Unaudited)	Year ended 31/03/2025 (Audited)
1	Total income from operations (net)	63032.32	153646.23	48352.28	130941.60	193423.03
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	12988.01	33871.97	10217.42	30696.51	43630.31
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	12988.01	33871.97	10217.42	30696.51	43630.31
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	9908.26	25748.15	7340.24	22858.77	32541.32
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and other Comprehensive Income (after tax)]	9899.46	25721.75	7333.46	22838.44	32506.12
6	Paid up Equity Share Capital (face value of Rs. 10 each)	1011.71	1011.71	1011.71	1011.71	1011.71
7	Earnings Per Share (not annualised)					
	Basic:	97.94	254.50	72.55	225.94	321.65
	Diluted:	97.94	254.50	72.55	225.94	321.65

Notes:

1) The above unaudited results for quarter and nine months ended December 31, 2025 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on Thursday, February 05, 2026.

2) Segment reporting as defined in IND-AS 108 is not applicable, since the Company has only one reporting segment i.e. Manufacturing of Electrical Transformers.

3) The above is an extract of the detailed format of quarter and nine months ended December 31, 2025. Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Company's website at www.voltamptransformers.com and on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com. The same can be accessed by scanning the QR code provided below.



FOR VOLTAMP TRANSFORMERS LIMITED

Sd /-

Kunjai L. Patel

Vice Chairman & Managing Director

DIN : 00008354

Date: February 05, 2026

Place: Vadodra